

B.Com. Semester - 5 (CBCS) Examination
Oct/Nov. - 2019
INDIRECT TAX LAW - 1(DISC. SPE. ELE -3)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-1	પરોક્ષ કર અધિકારીઓનું માળખું આપો. પરોક્ષ કર અધિકારીઓનું કાર્ય અને ભૂમિકા શું છે?.	(20)
	અથવા	
પ્રશ્ન-1	(અ) પરોક્ષ કરની સુવિધાઓ	(10)
	(બ) સીધો કર અને પરોક્ષ કર વચ્ચેનો તફાવત	(10)
પ્રશ્ન-2	સર્વિસ ટેક્સ એટલે શું? સર્વિસ ટેક્સની વિભાવના સમજાવો.	(20)
	અથવા	
પ્રશ્ન-2	(અ) “સેવા અને કરપાત્ર સેવા” સમજાવો.	(10)
	(બ) સર્વિસ ટેક્સના સામાન્ય સિદ્ધાંતો શું છે?	(10)
પ્રશ્ન-3	સર્વિસ ટેક્સની નોંધણી માટેની કાર્યવાહી	(15)
	અથવા	
પ્રશ્ન-3	ટ્રેડી નોંધ લખો:	
	(અ) સેનવેટ ક્રેડિટ	(08)
	(બ) કરપાત્ર સેવાઓનું મૂલ્યાંકન	(07)
પ્રશ્ન-4	ટ્રેડી નોંધ લખો: (કોઈપણ ત્રણ)	(15)
	(અ) વેટના સામાન્ય સિદ્ધાંતો.	(બ) ઈનપુટ ટેક્સ ક્રેડિટ.
	(ક) વેટ પ્રક્રિયા.	(ડ) વેટના ખ્યાલો.
	(ઈ) રચના યોજના.	

ENGLISH VERSION

Que-1	Give the structure of indirect Tax Authorities. What are the function and role of Indirect Tax Authorities?	(20)
	OR	
Que-1	(A) Features of Indirect Tax	(10)
	(B) Difference between Direct Tax and Indirect Tax.	(10)
Que-2	What is Service Tax? Explain the concept of Service Tax.	(20)
	OR	
Que-2	(A) Explain “Service & Taxable Service”.	(10)
	(B) What are the general principles of service tax?	(10)
Que-3	Procedure for registration of service tax.	(15)
	OR	
Que-3	Write short note:	
	(A) CENVAT Credit.	(08)
	(B) Valuation of Taxable Services.	(07)
Que-4	Write short note: (Any Three)	(15)
	(A) General principles of VAT.	(B) Input Tax Credit.
	(B) VAT procedure.	(D) Concepts of VAT.
	(E) Composition scheme.	
